

પદવીદાન સમારંભ : 2021
ઓનલાઇન અરજીપત્ર ભરવાની પ્રક્રિયા

આ અરજી પત્ર સહિતના કોઈપણ દસ્તાવેજોની હાર્ડ કોપી ગૂજરાત વિદ્યાપીઠને મોકલવાની નથી

1. પદવીદાન સંમારંભના અરજીપત્ર તા. 01-08-2021 થી તા. 16-08-2021 સુધી માત્ર ઓનલાઇન ભરી શકાશે. ફી રૂ. 700
2. તા. 17-08-2021 થી તા. 20-08-2021 સુધી પદવી ફી રૂ 700 + મોડાઈ ફી રૂ. 300 કુલ રૂ. 1000 ભરવાથી અરજીપત્ર ભરી શકાશે.
3. તા. 21/8/2021 થી અરજીપત્ર ભરી શકાશે નહીં.
4. www.gujaratvidyapith.org વેબસાઈટ પરની પદવીદાન અરજી પર ક્લિક કરવાથી અરજીપત્ર ખૂલશે.
5. ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ પર આપેલી લિંકથી SBI collect દ્વારા ફી ચૂકવવાની રહેશે. ફીની રસીદની PDF File અપલોડ કરવી.
6. તાજેતરનો પાસપોર્ટ કદનો ગૂજરાત વિદ્યાપીઠનો માન્ય ગણવેશવાળો ફોટો (JPEG File 50 Kb) અપલોડ કરવો.
7. સહી ગુજરાતી ભાષામાં અપલોડ કરવી.
સહી હિન્દી ભાષામાં અપલોડ કરવી.
સહી અંગ્રેજી ભાષામાં અપલોડ કરવી.
8. જે પદવી લેવાની હોય તે અભ્યાસક્રમના છેલ્લા વર્ષ/સત્રની ગુજરાતી/હિન્દી અને અંગ્રેજી એમ બન્ને ગુણપત્રો અપલોડ કરવા.
9. એકથી વધુ પદવી લેવાની હોય તો અલગ અલગ અરજી કરવાની અને અલગ અલગ ફી ભરવાની રહેશે.
10. અરજીપત્રમાં જરૂરી વિગતો ઓનલાઇન ભરીને submit કર્યા બાદ અરજીનો ઓનલાઇન સ્વીકાર થશે.

પદવીદાન સમારંભ સંબંધિત સૂચનાઓ

1. પદવીદાન સમારંભ પ્રાણજીવન છાત્રાલયના પટાંગણમાં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે તા. 18 ઓક્ટોબર 2021 ને શનિવારના રોજ યોજાશે.
2. 17 ઓક્ટોબરના દિવસે બપોરે 12-00 વાગ્યે પદવી પ્રમાણપત્ર પર સહી કરવા તથા અન્ય વસ્તુ/સામગ્રી લેવા અચૂક હાજર રહેવું.
3. પદવી માટે હાજર ન રહેનારની પદવી ફી પરત કરવામાં આવશે નહીં, પરંતુ પછીના વર્ષે ફી ભર્યાની પહોંચ રજૂ કર્યેથી વધારાના રૂ. 300/- ફી લઈને આગળની ભરેલી ફી ગ્રાહ્ય રાખવામાં આવશે.
4. પદવી પ્રમાણપત્ર હાજર રહીને જ મળી શકશે, પ્રમાણપત્ર પર વિદ્યાર્થીએ સહી કરવાની તથા પ્રતિજ્ઞા લેવાની હોય છે.
5. 18 ઓક્ટોબરના રોજ સવારના 9-00 વાગ્યે પોતાની બેઠક પર અચૂક બેસી જવું.
6. 17/18 ઓક્ટોબરના રોજ દરેક પદવી લેવા આવેલા વિદ્યાર્થીએ બે આંટી અચૂક લાવવી. એક બંધ આંટી મહેમાનશ્રીને અને એક બંધ આંટી કુલપતિજીને અલગ અલગ કરંડિયામાં અર્પણ કરવાની રહેશે. (તા. 17 ઓક્ટોબરે કાંતવા અંગેની વ્યવસ્થા આપવામાં આવશે, જેથી આંટી તૈયાર કરી શકાય.)
7. તા. 17 અને 18 ઓક્ટોબર બન્ને દિવસે
ખાદીનો ગણવેશ – ભાઈઓ : સફેદ લેંઘો, સફેદ ઝભ્ભો, સફેદ ટોપી
બહેનો : સફેદ બ્લાઉઝ, સફેદ સાડી (રંગીન કિનારી વગર)
8. પદવીદાન શરૂ થયેથી રાષ્ટ્રગીત પૂરું થાય ત્યાં સુધી દરેક પદવી લેનારાએ શિસ્તમાં પોતાના સ્થાને બેસી રહેવું. પદવીદાન પછી બધા જ પદવીધારકો માટે ભોજન વ્યવસ્થા રાખી છે.
9. પરીક્ષા નિયામક, પરીક્ષા વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-380014 ના નામે પત્રવ્યવહાર કરવો. ફોન નં. 079-40016214/232/233/234

કોરોના રોગચાળાની પરિસ્થિતિને આધીન ઉપરોક્ત વ્યવસ્થામાં ફેરફાર શક્ય છે.